

**Gujarat University**  
**P.G. Physiotherapy Admission 2021**  
**Reshuffling Counseling**

Date and Day	Time	Course	Merit Number	Venue
29/7/2021 Thursday	9:30 am	PG Physiotherapy	All the candidates included in Merit list*	<b>Kasauti Hall, Ground Floor, B.J.Medical College, Ahmedabad-380016</b>

- \*પ્રથમ કાઉન્સિલીંગ માં પ્રવેશ મેળવેલ તમામ ઉમેદવારોએ રીશફલીંગ કાઉન્સિલીંગમાં ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે અન્યથા તેઓનો પ્રવેશ રદ કરવામાં આવશે.
- \*જે ઉમેદવારોએ પ્રથમ કાઉન્સિલીંગ માં મળેલ પ્રવેશ ચાલુ રાખવો હોય તે ઉમેદવારોએ પણ ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે, અન્યથા તેઓનો પ્રવેશ રદ કરવામાં આવશે.
- \*જે ઉમેદવારોએ કોલેજ/સંસ્થા માં Reporting/ Joining ના કરેલ હોય અથવા સંસ્થા ખાતે પ્રવેશ રદ કરાવેલ હોય તે ઉમેદવારોએ રીશફલીંગ કાઉન્સિલીંગમાં હાજર રહેવાની જરૂર રહેતી નથી અને તેમને ફી અને ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ પ્રવેશ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રવેશસમિતિ ખાતેથી પરત મેળવી લેવાના રહેશે.
- \*જે ઉમેદવારોએ સંસ્થા ખાતે પ્રવેશ રદ કરાવેલ નથી તે ઉમેદવારોએ પ્રવેશ રદ કરાવા માંગતા હોય તો તે માટે રીશફલીંગ કાઉન્સિલીંગમાં ફરજિયાતપણે હાજર રહી પ્રવેશ રદ કરાવી શકશે
- \*જે ઉમેદવારોએ વધારે ફી ભરી હશે તો વધારાની ફી રીફંડ લેવા માટે બેંક ના "ચેક" ની ફોટો કોપી રીશફલીંગ કાઉન્સિલીંગમાં લાવવાની રહેશે.

**Note:**

1. All Candidates have to remain present 30 minutes before commencement of counseling at venue and till announcement of conclusion of counseling, If any candidate leaves the hall, he/she loose the claim for admission.
૧. બધા ઉમેદવારોએ રીશફલીંગ કાઉન્સિલીંગના સ્થળ પર કાઉન્સિલીંગ શરૂ થયાના 30 મિનિટ પહેલાં અને કાઉન્સિલીંગ સમાપ્તિની ઘોષણા ન થાય ત્યાં સુધી હાજર રહેવું પડશે. જો કોઈ ઉમેદવાર કાઉન્સિલીંગ સમાપ્તિની ઘોષણા પહેલાં સભાખંડ છોડીને જશે, તો તે પ્રવેશ માટે દાવો કરી શકશે નહીં.
2. Branch/Institute which was offered to candidate at his/her merit number during first counseling will not be offered in Reshuffling counselling.
૨. પ્રથમ કાઉન્સિલીંગ દરમિયાન તેના / તેણીના મેરીટ નંબર પર ઉમેદવારને જે બ્રાંચ/સંસ્થા ઓફર કરવામાં આવેલ હશે તે રીશફલીંગ કાઉન્સિલીંગ માં ઓફર કરવામાં આવશે નહીં.
3. If candidates cannot come in person then authorized person may come with proper authority letter, for counseling.
૩. જો ઉમેદવાર રૂબરૂ ન આવી શકે તો અધિકૃત વ્યક્તિ ઓથોરીટી પત્ર સાથે રીશફલીંગ કાઉન્સિલીંગ માટે આવી શકે છે.
4. In view of the Situation of Covid 19 Global Pandemic, Candidates have to wear Mask & follow the Social distancing norms.
૪. કોવિડ 19 ગ્લોબલ રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ માસ્ક પહેરવો અને સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું.
5. Candidate must have completed internship before the date of first counseling. Candidate should have to produce internship completion certificate at the time of counseling, failing which, candidate will not be eligible for admission.
૫. ઉમેદવારની પ્રથમ કાઉન્સિલીંગ ની તારીખ પહેલાં ઇન્ટર્નશીપ પૂર્ણ થયેલી હોવી જોઈએ. રીશફલીંગ કાઉન્સિલીંગ સમયે ઉમેદવારે ઇન્ટર્નશીપ પૂર્ણતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો ઉમેદવાર પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો તે ઉમેદવાર પ્રવેશ માટે પાત્ર રહેશે નહીં.
6. Candidate who had taken admission in first round of Counseling and joined at concerned College/Institute should bring the Admission order at the time of Reshuffling Counselling.
૬. કાઉન્સિલીંગના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર અને સંબંધિત કોલેજ/સંસ્થામાં જોડાયેલા ઉમેદવારોએ રીશફલીંગ કાઉન્સિલીંગ સમયે એડમીશન ઓર્ડર અને બાંહેધરી (અહીં જોડેલ) અચૂક લાવવાનું રહેશે.

7. Those candidates who have not taken admission in First counselling must bring all the original documents at the time of Counseling in following sequence[All Mark sheets of all year, Attempt Certificate, Internship Completion Certificate, Caste certificate issued by competent authority of Gujarat State (if applicable), Non Creamy layer Certificate of financial year pertaining to the period of application from the competent authority as prescribed by the Govt. of Gujarat for SEBC, EWS(Economical Weaker Section) certificate issued by competent authority of Gujarat State, School leaving certificate, Undertaking, Certificate of completion of PG Course (If Applicable), For In-service Candidates- study leave/resignation as per rule 7.8 ]

૭. જે ઉમેદવારોએ પ્રથમ કાઉન્સલિંગમાં પ્રવેશ લીધેલ નથી તેવા ઉમેદવારોએ નીચે મુજબ ક્રમમાં તમામ અસલ પ્રમાણપત્રો લાવવા આવશ્યક છે, [બધા વર્ષની બધી માર્કશીટ, એટેમ્પટ/ટ્રાયલ નું પ્રમાણપત્ર, ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા નું પ્રમાણપત્ર, ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), SEBC ના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા સૂચવેલા સક્ષમ અધિકારી પાસેથી અરજીના સમયગાળાને લગતા નાણાકીય વર્ષ નું નોનક્રીમીલેયર પ્રમાણપત્ર અને EWS (આર્થિક નબળા વિભાગ) ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા આપેલ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, અન્ડરટેકિંગ(બાંહેધરી), પી.જી. કોર્ષ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો), અભ્યાસ રજા / રાજીનામું નિયમ ૭.૮ પ્રમાણે]

- Candidates who have not taken admission in 1<sup>st</sup> Counselling should bring envelope of 11x15 inch size. Write the following details on envelope with marker:

<b>Name of Candidate: (As per Marksheet)</b>		
<b>User ID:</b>		<b>Category:</b>
<b>General Merit No.:</b>		
<b>Category Merit No.:</b>		
<b>Mobile No.:</b>		
<b>E-mail id:</b>		
<b>Allotted Institute in Reshuffling Counselling:</b>		
<b>Allotted Seat Category in Reshuffling Counselling:</b>		
<b>List of Document submitted:</b> (Please write Y/N in the box for relevant documents)	1.	
	2.	
	3.	
	4.	
	5.	
	6.	
	7.	
	8.	

8. Verification of all the original documents/Admission Order and undertaking (Attached herewith) will be done before counseling. Any candidate failed to produce any original document/Admission order and undertaking will not be included for admission process. The envelope containing all original documents will be kept by the Admission Committee if candidate will get the admission in any branch.

૮. બધા અસલ પ્રમાણપત્રો/એડમીશન ઓર્ડર અને બાંહેધરી (અહી જોડેલ) ની ચકાસણી કાઉન્સેલિંગ પહેલાં કરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર કોઈપણ મૂળ પ્રમાણપત્રો /એડમીશન ઓર્ડર અને બાંહેધરી રજુ કરવામાં નિષ્ફળ જશે તો તેમને પ્રવેશ પ્રક્રિયા માટે સામેલ કરવામાં આવશે નહીં. જે ઉમેદવારોને પ્રવેશ મળશે તેમના તમામ અસલ પ્રમાણપત્રો ધરાવતું કવર, પ્રવેશ સમિતિ દ્વારા રાખવામાં આવશે.

9. Those Candidates who had taken admission in first round of Counselling and/or joined at concerned College/Institute also have to remain present compulsorily for Reshuffling Counselling and must pay the required University Registration fees and University Tuition Fees (Please refer point 13 of this schedule) and College Tuition Fees (Please refer point 10 & 12 of this schedule) otherwise their admission will be cancelled.

૯. જે ઉમેદવારે પ્રથમ કાઉન્સેલિંગમાં પ્રવેશ લીધો હોય અને સંબંધિત કોલેજ/સંસ્થામાં જોડાયા હોય તેઓએ પણ રીશફ્લિંગ કાઉન્સેલિંગ દરમ્યાન ફરજિયાતપણે હાજર રહેવું પડશે અને યુનિવર્સિટી રજીસ્ટ્રેશન ફી અને યુનિવર્સિટી ટ્યુશન ફી (આ શિડ્યુલના ક્રમાંક 13 મુજબ) તેમજ કોલેજ ટ્યુશન ફી (આ શિડ્યુલના ક્રમાંક 10 અને 12 મુજબ) ભરવાની રહેશે અન્યથા તેમનું પ્રવેશ રદ કરવામાં આવશે.

10. Candidates who have taken admission in 1<sup>st</sup> Counselling/Reshuffling Counselling at Government Physiotherapy College has to pay whole course tuition fees (two years) as mentioned below by cash &/or Demand Draft in favor of “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad at bank facility provided by Admission Committee at the place of counseling immediately otherwise their admission will be cancelled.

૧૦. જે ઉમેદવારો એ પ્રથમ કાઉન્સેલિંગ/રીશફ્લિંગ કાઉન્સેલિંગ દરમ્યાન ગવર્નમેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ મેળવેલ હશે અને પ્રવેશ ચાલુ રાખવા માંગતા હોય તેઓએ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે પ્રવેશ સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવેલી બેંક સુવિધામાં “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad” ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ/ રોકડથી સમગ્ર અભ્યાસક્રમ (બંને વર્ષ)ની બાકી રહેતી કોલેજ ટ્યુશન ફી જમા કરાવવાની રહેશે અન્યથા તેઓ નો પ્રવેશ રદ કરવામાં આવશે/ પ્રવેશ ફાળવવામાં આવશે નહિ.

For Candidates who have taken admission in 1 <sup>st</sup> Counselling at Government Physiotherapy College (જે ઉમેદવારો એ પ્રથમ કાઉન્સેલિંગ દરમ્યાન ગવર્નમેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ મેળવેલ છે તેમના માટે)		
Name of the College	College Tuition Fees Paid in 1 <sup>st</sup> Counselling	Remaining College Tuition Fees to be paid in Reshuffling Counselling
Govt. Physiotherapy College	Rs. 20,000/-	Rs. 20,000/-

For Candidates who takes admission in Reshuffling Counselling (જે ઉમેદવારો રીસફ્લિંગ કાઉન્સેલિંગ દરમ્યાન ગવર્નમેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ મેળવે છે તેમના માટે)	
Name of the College	College Tuition Fees to be Paid in Reshuffling Counselling
Govt. Physiotherapy College	Rs. 40,000/-

11. Candidates who take admission in Reshuffling Counselling at Self Finance Colleges have to pay college tuition fees of **one term** by cash &/or Demand Draft in favor of “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad at bank facility provided by Admission Committee at the place of counseling immediately otherwise candidate will not be eligible for admission. **Excess fees will be refunded at the end of entire admission process.**

૧૧. જે ઉમેદવારો રીસફ્લિંગ કાઉન્સેલિંગ દરમ્યાન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ખાતે પ્રવેશ મેળવશે તેઓએ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે પ્રવેશ સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવેલી બેંક સુવિધામાં “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad” ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ/રોકડ દ્વારા એક ટર્મની ટ્યુશન ફી ચૂકવવાની રહેશે. જો ટ્યુશન ફી ભરવામાં નિષ્ફળ જશે તો પ્રવેશ માટે પાત્ર રહેશે નહીં. વધારાની ફી પ્રવેશ ની સંપૂર્ણ પ્રક્રિયાના અંતે પરત કરવામાં આવશે.

For Candidates who takes admission in Reshuffling Counselling (જે ઉમેદવારો રીસફ્લિંગ કાઉન્સેલિંગ દરમ્યાન પ્રવેશ મેળવે છે તેમના માટે)	
Name of the College	One term College Tuition Fees to be Paid during Reshuffling Counselling
S.B.B College of Physiotherapy	Rs. 1,92,000/-
J.G. College of Physiotherapy	Rs. 1,00,000/-
AIMS Physiotherapy College	Rs. 99,000/-
Sharda College of Physiotherapy	Rs. 50,000/-
Apollo College of Physiotherapy	Rs. 60,000/-
Swaminarayan College of Physiotherapy	Rs. 75,000/-
Ananya College of Physiotherapy	Rs. 50,000/-

12. Candidates who have taken admission in 1<sup>st</sup> Counselling and upgrades his/her admission in Reshuffling Counselling has to pay difference in College tuition fees by cash / Demand Draft otherwise they will not be allotted admission. Excess fees will be refunded at the end of whole admission process

૧૨. જે ઉમેદવાર પ્રથમ કાઉન્સલિંગ માં મળેલ પ્રવેશ રીસફલીંગ કાઉન્સલિંગ માં બદલે છે, તેમને તફાવત ની ટ્યુશન ફી રોકડ/ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે અન્યથા પ્રવેશ ફાળવવામાં આવશે નહીં. વધારાની ફી ભરેલ હશે તો પ્રવેશ ની સંપૂર્ણ પ્રક્રિયાના અંતે પરત કરવામાં આવશે.

13. Candidates who have taken admission in 1<sup>st</sup> Counselling has to pay University Registration and Tuition fees as mentioned in the table below by Demand Draft or Cash Otherwise their admission will be cancelled.

Candidates who take admission in Reshuffling Counselling also has to pay University Registration and Tuition fees as mentioned in the table below by Demand Draft or Cash Otherwise they will not be allotted admission.

૧૩. જે ઉમેદવારો એ પ્રથમ કાઉન્સલિંગ દરમિયાન પ્રવેશ મેળવેલ હશે તેઓ એ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે યુનિવર્સિટી રજીસ્ટ્રેશન અને યુનિવર્સિટી ટ્યુશન ફીનો ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા રોકડ જમા કરાવવાનું રહેશે અન્યથા તેમનો પ્રવેશ રદ કરવા માં આવશે.

જે ઉમેદવારો રીસફલીંગ કાઉન્સલિંગ દરમિયાન પ્રવેશ મેળવશે તેઓએ પણ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે યુનિવર્સિટી રજીસ્ટ્રેશન અને યુનિવર્સિટી ટ્યુશન ફીનો ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા રોકડ માં જમા કરાવવાનું રહેશે અન્યથા તેમને પ્રવેશ ફાળવવામાં આવશે નહીં.

	Fees For Girl Students of Government Colleges	Fees For All Other Students
	MPT/MSC Nursing/NPCC/ / M.Opto.	MPT/MSC Nursing/NPCC/ / M.Opto.
<b>Registration /Admission/Enrolment fees</b>	<b>Rs.15300=00</b>	<b>Rs.15300=00</b>
<b>University Tuition Fees (All Terms) (Rs.3500=00 x 4)</b>	<b>Nil</b>	<b>Rs.14000=00</b>
<b>Cultural Fees</b>	<b>Rs.50=00</b>	<b>Rs.50=00</b>
<b>Total</b>	<b>Rs.15350=00</b>	<b>Rs.29350= 00</b>

Candidate should submit demand draft of above university fees in favor of “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad, at the time of reshuffling counseling.

ઉમેદવારે ઉપરોક્ત યુનિવર્સિટી રજીસ્ટ્રેશન અને યુનિવર્સિટી ટ્યુશન ફીનો ડીમાન્ડ ડ્રાફ્ટ “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad ના નામે રીસફલીંગ કાઉન્સલિંગ સમયે જમા કરાવવાનો રહેશે.

**A table has been attached in last page to understand point no. 9 to 13. All candidates have to follow the instructions given in the table.**

ક્રમાંક ૯ થી ૧૩ ને સમજાવતું કોષ્ટક છેલ્લા પાને જોડેલ છે અને તેમાં આપેલ સુચનાનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.

14. After getting admission order the candidate must join the institute immediately. Allotment of P.G teacher will be done as per merit by the respective allotted college.

૧૪. એડમીશન ઓર્ડર મળ્યા પછી ઉમેદવારે સંસ્થામાં તાત્કાલિક જોડાવુ આવશ્યક છે. પી.જી. શિક્ષકની ફાળવણી તમને ફાળવેલ કોલેજ દ્વારા તમારા મેરીટ મુજબ કરવામાં આવશે.

15. Candidate should join the course immediately. Seats will be deemed to be surrender to college/institute if vacancies arises due to any reasons after Reshuffling Counselling and such seats will be filled by concerned college/institute within the prescribe time limit as per Gujarat University Rules.

૧૫. ઉમેદવારે કોર્સમાં તાત્કાલિક જોડાવાનું રહેશે. જો રીસફલીંગ કાઉન્સલિંગ બાદ બેઠકો કોઈપણ કારણોસર ખાલી પડે તો જે તે કોલેજ / સંસ્થાને સમર્પિત કરવામાં આવશે અને આવી બેઠકો ગુજરાત યુનિવર્સિટીના નિયમો અનુસાર નિયત સમય મર્યાદામાં સંબંધિત કોલેજ / સંસ્થા એ ભરવાની રહેશે.

16. All candidates have to submit the undertaking (Attached herewith) at the time of Reshuffling Counselling failing which candidate will not be considered for counselling.

૧૬. બધા ઉમેદવારોએ રિશફલિંગ કાઉન્સલિંગમાં Undertaking(બાંહેધરી) (અહી જોડેલ) જમા કરાવાનું રહેશે. જો Undertaking જમા કરાવશે નહી તો તે ઉમેદવાર ને રિશફલિંગ કાઉન્સલિંગ માટે માન્ય ગણાશે નહી.

17. If Candidate admitted and not joined the course or resign from course/left the course after Reshuffling Counseling, in such conditions, or in case of implementation of rules 1.3,1.5,1.7,6.5,7.8,7.10,7.12, following conditions imposed on the Candidates.

(Candidates must have to give the undertaking that he/she abide to all the below mentions conditions.)

- i. His / Her admission and registration shall be cancelled without any notice thereof.
- ii. Candidate will not eligible for future admission in this University.
- iii. Candidates have to pay the course fees of all the year/academic terms.
- iv. All deposit amount, Admission fees, tuition fees and university fees are forfeited and Candidate cannot claim on it.
- v. Candidates have to pay Rs. 1 lakh as a penalty to the Gujarat University.

૧૭. જો ઉમેદવારને પ્રવેશ મળ્યો હોય અને રીશફલિંગ કાઉન્સલિંગ બાદ કોર્સમાં જોડાય નહી અથવા કોર્સમાંથી રાજીનામું આપે/કોર્સ છોડી દે તો તેવા કિસ્સામાં, અથવા નિયમો 1.3,1.5,1.7,6.5,7.8,7.10,7.12 ના અમલીકરણના કિસ્સામાં, નીચેની શરતો ઉમેદવાર પર લાગુ કરવામાં આવશે. (ઉમેદવારોએ તે બાંધધરી આપવી આવશ્યક છે કે તે નીચેની તમામ શરતોનું પાલન કરશે.)

- i. તેનું/તેણીનું પ્રવેશ અને રજીસ્ટ્રેશન કોઈ સૂચના વિના રદ કરવામાં આવશે.
- ii. ઉમેદવાર આ યુનિવર્સિટીમાં ભવિષ્યમાં પ્રવેશ માટે પાત્ર રહેશે નહીં.
- iii. ઉમેદવારે તમામ વર્ષ / શૈક્ષણિક સત્ર ની કોર્સ ફી ચૂકવવાની રહેશે.
- iv. ઉમેદવારની તમામ ડીપોઝીટની રકમ, પ્રવેશ ફી, ટ્યુશન ફી અને યુનિવર્સિટી ફી પરત કરવામાં આવશે નહી અને ઉમેદવાર તેના પર દાવો કરી શકશે નહી.
- v. ઉમેદવારે રૂ.૧,૦૦,૦૦૦,- (રૂપિયા એક લાખ) ગુજરાત યુનિવર્સિટીને દંડ રૂપે ભરવાના રહેશે.

18. Information regarding Seats vacant for Reshuffling Counselling will be declared on [www.gujaratuniversity.ac.in](http://www.gujaratuniversity.ac.in) and [www.gupgmedadm.org](http://www.gupgmedadm.org) soon.

૧૮. રીશફલિંગ કાઉન્સલિંગ માટે ખાલી બેઠકો ની માહિતી ટૂંક સમયમાં [www.gujaratuniversity.ac.in](http://www.gujaratuniversity.ac.in) અને [www.gupgmedadm.org](http://www.gupgmedadm.org) પર જાહેર કરવામાં આવશે.

Chairman  
PG Physiotherapy & Nursing Admission Committee,  
Gujarat University

Copy to-

1. The Principal , All the Concerned Colleges/Institutes
2. All the Members, PG Physiotherapy & Nursing Admission Committee,
3. The Registrar, Gujarat University
4. The Post Graduate Section, Gujarat University
5. The Director, Rollawala Computer Center, Gujarat University (For display on Gujarat University Website)
6. Notice board of All the Concerned Colleges
7. Microtech IT Systems Pvt. Ltd.

**રીશફલીંગ કાઉન્સીલીંગ સમયે ફીસ ભરવા માટે ની સુચનાઓ/વિગતો**

	<b>University Registration Fees and University Tuition Fees</b>	<b>Government College Tuition Fees (Whole Course Fees)</b>	રીશફલીંગ કાઉન્સીલીંગ સમયે ભરવાની થતી તમામ ફી
ગવર્નમેન્ટ કોલેજમાં પ્રથમ કાઉન્સીલીંગ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે	Boys - <b>Rs.29350</b> Girls - <b>Rs.15350</b>	Rs. 20,000/- (પ્રથમ કાઉન્સીલીંગ સમયે ભરેલ ફી.) Rs. 20,000/- (રીશફલીંગ કાઉન્સીલીંગ સમયે ભરવાની થતી ફી)	Boys – Rs. 49,350 Girls – Rs. 35,350
ગવર્નમેન્ટ કોલેજમાં રીશફલીંગ કાઉન્સીલીંગ માં નવો પ્રવેશ મળે તે વિદ્યાર્થીઓ માટે	Boys - <b>Rs.29350</b> Girls - <b>Rs.15350</b>	Rs. 40,000/-	Boys – Rs. 69,350 Girls – Rs. 55,350
પ્રથમ કાઉન્સીલીંગ માં સેલ્ફ-ફાયનાન્સ કોલેજ માંથી રીશફલીંગ કાઉન્સીલીંગ માં ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવેશ મળે તે વિદ્યાર્થીઓ માટે	Boys - <b>Rs.29350</b> Girls - <b>Rs.15350</b>	Rs. 40,000/-	Boys - Total - Rs 69350 Girls – Total – Rs. 55350 પ્રથમ કાઉન્સીલીંગ માં ઉપર કરતા વધારે ફી ભરી હશે તો વધારાની ફી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી રીફંડ કરવામાં આવશે.
	<b>University Registration Fees and University Tuition Fees</b>	<b>Self-Financed Institute Tuition Fees (One Term Fees)</b>	રીશફલીંગ કાઉન્સીલીંગ સમયે ભરવાની થતી તમામ ફી
પ્રથમ કાઉન્સીલીંગ માં મળેલ સેલ્ફ-ફાયનાન્સ કોલેજ માંથી રીશફલીંગ કાઉન્સીલીંગ માં અન્ય સેલ્ફ-ફાયનાન્સ કોલેજમાં પ્રવેશ મળે તે વિદ્યાર્થીઓ માટે	Boys - <b>Rs.29350</b> Girls - <b>Rs.29350</b>	S.B.B College of Physiotherapy	Rs. 1,92,000/-
		J.G. College of Physiotherapy	Rs. 1,00,000/-
		AIMS Physiotherapy College	Rs. 99,000/-
		Sharda College of Physiotherapy	Rs. 50,000/-
		Apollo College of Physiotherapy	Rs. 60,000/-
		Swaminarayan College of Physiotherapy	Rs. 75,000/-
		Ananya College of Physiotherapy	Rs. 50,000/-
સેલ્ફ-ફાયનાન્સ કોલેજમાં રીશફલીંગ કાઉન્સીલીંગ માં નવો પ્રવેશ મળે તે વિદ્યાર્થીઓ માટે	Boys - <b>Rs.29350</b> Girls - <b>Rs.29350</b>	S.B.B College of Physiotherapy	Rs. 1,92,000/-
		J.G. College of Physiotherapy	Rs. 1,00,000/-
		AIMS Physiotherapy College	Rs. 99,000/-
		Sharda College of Physiotherapy	Rs. 50,000/-
		Apollo College of Physiotherapy	Rs. 60,000/-
		Swaminarayan College of Physiotherapy	Rs. 75,000/-
		Ananya College of Physiotherapy	Rs. 50,000/-

**અગત્ય ની સુચના :**

- The Fee structure shown here is of last/previous (2020-21) year. New Fee structure for the year 2021-22 will be applicable as per the decision of fees regulatory committee (Medical), Gujarat State. Candidate has to pay the difference of amount, if applicable
- The candidate has to pay above fees by cash &/or Demand Draft in favor of “MPT MSC (NURSING) ADM COMMITTEE GUJ UNI” Payable at Ahmedabad at bank facility provided by Admission Committee at the place of counseling immediately otherwise candidate will not be eligible for admission. Excess fees will be refunded at the end of entire admission process.
- Candidate who have paid excess fees have to bring Xerox Copy of Cheque during the reshuffling counselling for Refund process.

**Undertaking (For PG Physiotherapy Candidates)**

**(Candidate should submit the undertaking at the time of Reshuffling Counselling)**

I hereby declare that the information given in this application including accompaniments is true. If anything is found to be incorrect or false or misleading at any time, I understand that my admission shall be cancelled and I may be prosecuted, also I shall be ineligible to apply in future. I shall abide by the results.

I have read and understood all the rules and regulations of Post-Graduate Physiotherapy Admission 2021 of Gujarat University and I shall abide by all the rules and regulations. I accepted all the terms and conditions pertaining to Admission to Post Graduate Physiotherapy courses and I does not have any objections with rules and regulations.

I am not engaged in any post graduate course in any institute at the time of submission of Application form & at present. After my admission, If I do not join the course or resign from course/left the course after Reshuffling Counseling, in such conditions, or in case of implementation of rules 1.3, 1.5, 1.7, 6.5, 7.8, 7.10, 7.12, of post-graduate admission 2021, my admission and registration shall be cancelled without any notice thereof. In such situation, I also understand that,

1. My admission and registration will be cancelled without any notice thereof.
2. I will not be eligible for future admission in this University.
3. I have to pay the whole course fees of all the year/academic terms of College and University.
4. My all deposit amount, Admission fees, tuition fees and university fees are forfeited and I will have no claim on it.
5. I have to pay Rs. 1 lacs as a penalty to the Gujarat University.

If I do not comply with above conditions, then all the original documents will not be return to me and legal action will be initiated against me.

I have verified my eligibility to apply against the category to which i am entitled. if I found to be ineligible for the category in which i had applied then i cannot claim any right in future for admission or my admission can be cancelled.

Students admitted in post graduate course has to apply for registration in the prescribed form duly completed, through the College concerned within one month from the last date of Joining of reshuffling counselling/final round of counselling. If it does not reach to the University within one month from the last date of Joining of reshuffling counselling/final round of counselling than one term of Candidate will not be granted and if it is applied later than above time limit than as per date of application of registration, term/terms will not be granted depending upon the date of application of Registration.

Students admitted in post graduate course has to submit the topic of Dissertation in the prescribed form duly completed, through the College concerned within three month from the last date of Joining of reshuffling counselling/final round of counselling. If it does not reach to the University within three month from the last date of Joining of reshuffling counselling/final round of counselling than one term of Candidate will not be granted and if it is submitted later than above time limit than as per the date of submission of topic of Dissertation, term/terms will not be granted depending upon the date of submission of topic of Dissertation.

I have also verified my eligibility for appearance at the Entrance examination/Post Graduate Physiotherapy Admission. If through mistakes/error the forms are accepted and through mistake/error I appeared in Entrance examination /admitted in Post Graduate Physiotherapy course & if I found to be ineligible, in such case I cannot claim any right or interest arising out of acceptance of form or appearance at the Entrance examination/admission in Post Graduate Physiotherapy course.

**Name :**

**Reg. No. :**

Comb. Merit No:

Signature:

Date: